



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થ ગણાત્રા, માનદ્ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, કારોબારી સભ્યશ્રી નિલેશભાઈ ભલાણીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના વિવિધ મહત્વના પ્રશ્નો અંગે રજુઆત કરેલ.

(૧) રાજકોટને ઈનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) ની માંગણી ઉકેલવા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાત્રી આપેલ છે. ICD થી એક્સપોર્ટ બીઝનેસમાં સારો વધારો થશે, ઉદ્યોગકારોને ફાયદો થશે. આઈસી.ડી.નો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલવા મુખ્યમંત્રીશ્રીએ ખાત્રી આપેલ છે.

(૨) ગુજરાતની નવી ઔદ્યોગીક નીતી-૨૦૨૦ જાહેર થઈ તેમા તાલુકાઓને કેટેગરી ૧,૨,૩ માં મુકવામાં આવેલ છે. જેમા મહદઅંશના તાલુકાઓને કેટેગરીમાં ફેરફાર કરવાની રાજકોટ ચેમ્બરે રજુઆત કરતા ગુજરાત ઈન્ડસ્ટ્રી કમિશ્નર શ્રી રાહુલ ગુપ્તા સાહેબએ ઘટતુ કરવા ખાત્રી આપેલ.

(૩) રાજકોટ ચેમ્બરના અથાગ પ્રયત્નોથી રાજકોટ એરપોર્ટ પરથી ઘણી બધી ફ્લાઈટો શરૂ થયેલ હોય તેમા રાજકોટ -સુરતની ફ્લાઈટ પણ ચાલુ થયેલ. પરંતુ હાલ તે બંધ થયેલ હોય તેને ફરીથી ચાલુ કરવા માંગણી કરેલ. તેમા સરકારશ્રી એવીએશન મીનીસ્ટર દિલ્હીને ભલામણ કરશે.

(૪) મોટી સાહેબના TOY પાર્ક સ્થાપના વિઝનને ગુજરાત રાજ્યે સહમતી આપેલ હોય. આવો મોટો પાર્ક રાજકોટમાં સ્થાપવા માટે ભલામણ કરેલ છે. રાજકોટમાં સરકારી જમીનની પણ પુરે પુરી ઉપલબ્ધી છે. તેમજ TOY પાર્કના રોમટીરીયલ્સ-પાર્ટસનું ઉત્પાદન ૭૫% રાજકોટમાં થાય છે. જેથી આ ઉદ્યોગમાં સરળતા રહે અને સ્થાનીક લોકોને મોટી રોજગારી ઉભી થાય.

(૫) સૌરાષ્ટ્ર માં ઘણી બધી MSME ઈન્ડસ્ટ્રી સ્થાપેલ હોય તેમજ MSME ની મર્યાદા ૨૦૦ કરોડ સુધી વધારેલ હોય તેને ધ્યાનમા રાખીને જી.આઈ.ડી.સીમાં ૩૦૦૦ ચો. મીટરને બદલે જો ૬૦૦૦ ચો.મીટર ઉદ્યોગકારોને ૫૦ ટકાના દરે આપવામાં આવે તો ઉદ્યોગોનો સારો એવો વિકાસ થાય અને MSME સેક્ટરને બુસ્ટ મળે જેની માંગણી કરેલ છે.

(૮) હાલમાં ઔદ્યોગીક એકમો માટે લેવામાં આવતા ફાયર NOC મ્યુનિસીપલ કોર્પોરેશન અથવા સબંધીત રેગ્યુલેટરી બોર્ડ આપે છે. તેને બદલે માત્ર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવી જોઈએ જેથી ઉદ્યોગકારોને હેરાનગતી ઓછી થાય.

(૯) રાજકોટમાં ઉદ્યોગો વધી રહ્યા છે. જેથી નવી GIDC ની આવશ્યકતા હોય રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસે અને રાજકોટ-ભાવનગર હાઈવે પર ગઢડા પાસે સરકારી ખરાબાની જમીન આવેલ છે. જે નવી GIDC સ્થાપવા માટે ઘણી ઉપયોગી છે. તો તાત્કાલીક અસરથી ઘટતું કરવાની માંગણી કરેલ.

(૧૦) ઔદ્યોગીક એકમોના વિકાસ માટે GIDC દ્વારા એલોટ કરેલા પ્લોટ માં એફ.એસ.આઈ. ૧.૬ માંથી ઘટાડીને ૧ કરેલ છે. તે બદલી ને ૧.૬ રાખવી તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં નવા જી.ડી.સી.એલ. મુજબ અમલ કરવો તેમ ખાસ અનુરોધ કરેલ છે.

(૧૧) રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અગાઉ પણ કન્વેન્શન સેન્ટર તેમજ રાજકોટ ચેમ્બરની ઓફિસની જગ્યા માટેની માંગણી કરેલ હતી જે અંગે વિસ્તૃત ચર્ચા કરતા સરકાર રાજકોટ ચેમ્બરને જગ્યા તેમજ કન્વેન્શન સેન્ટર માટેની જગ્યા પુરતા પ્રમાણમાં નહીવત દરે ફાળવશે. તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ મેનેજમેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને કરવાનું રહેશે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

(૧૨) કોરોના વાઈરસને કારણે ઓક્સીજન પ્લાન્ટ ઈન્ડસ્ટ્રીઝ વપરાશ માટે બંધ હતા ત્યારે જે એકમોમાં ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટના કામો ચાલુ હતા તે કાર્યમાં ઓક્સીજન સપ્લાય ના હિસાબે કાર્ય સમય મર્યાદામાં પૂર્ણ ન થઈ શકાયું હોય તેવા એકમોને કોન્ટ્રાક્ટની સમય મર્યાદામાં વધારો કરી આપવો તેમજ તેની પાસે પેનલ્ટી ન વસુલવા બાબત રજુઆત કરી.

(૧૩) રાજકોટમાં રામનગર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનમાં આવેલ ૨૫૦ થી વધુ ઔદ્યોગીક એકમો પાસે થી નિયમ મુજબ ફી વસુલ કરીને તેને નિયમીતકરવા બાબત.

આમ રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ પ્રશ્નો અંગે મૌખિક તથા લેખિત રજુઆત માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ ચીફ પ્રીન્સીપલ સેક્રટરી શ્રી કૌલાશનાથન સાહેબ, ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન ડિપાર્ટમેન્ટના એડી.ચીફ સેક્રટરીશ્રી રાજીવ ગુપ્તા સાહેબ, ઉદ્યોગ કમિશ્નરશ્રી રાહુલ ગુપ્તા સાહેબ, જી.આઈ.ડી.સી.ના એમ.ડી. એમ.થેન્નાર્શન સાહેબ, તથા ઈન્ડસ્ટ્રીયલ એકટેન્શન બ્યુરોના એમ.ડી.શ્રી નિલમ રાની મેડમ, એમ.એસ.એમ.ઈ. કમિશ્નરશ્રી રણજીથ કુમાર સમક્ષ રજુઆત કરેલ. મુખ્યમંત્રીશ્રીએ સહાનુભૂતિ આપેલ અને રાજકોટ ચેમ્બર દ્વારા ધ્યાન પર મુકેલ પ્રશ્નો અંગે તુરંત યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.